

નામ પાડવાનું શાન અને અહેલેબૈતનાં નામો

લેખક

અધ્યાત્મા નસીરુદ્દીન નસીર હુંજાઈ

પ્રકાશક

ખાનાએ હિકમત-ઈદારાએ આરીઝ

નામ પાડવાનું જ્ઞાન

અને

અહેલેબૈતનાં નામો

ISW
LS

લેખક

અક્ષામા નરીદીન નરીર હુંગાઈ

Institute for
Spiritual Wisdom
Anupwadak
Akbar Jhunjhunwala
Luminous Science

Knowledge for a united humanity.

પ્રકાશક

ખાનાએ હિકમત-ઇંડારાએ આરીઝ

3-A, નૂર વીલા, ૨૬૮, ગાર્ડન વેસ્ટ,

કરાચી-3.

નામ પાડવાનું શાન અને અહેલેબેતનાં નામો

ફરમાન મુખ્યારક

હુંગા અને ગીલગીટની જમાતો માટે રેઝિયો મારક્ષત
મુંબઈથી તારીખ ૧૦મી માર્ચ ૧૯૪૭ના, હજસન ઈમામ સુલતાન
મુહમ્મદશાહ (સ.અ.)એ ફરમાવ્યું :

“હિનુસ્તાનની દ્વારા સરહદેની સંઘળી જમાતો, દાખલા તરીકે
ચિત્રાલ, હુંગા, ગીલગીટ અને બદખણના સંઘળા મિત્રો અને શુલ્ભેચ્છાને
નેક દુઅઓમાં પાંડ કરું છું. વિશ્વાસ રાખો કે મારા પ્રેમ અને દ્વારાનું
નૂર હુંગાની પૂરી જમાત ઉપર સૂર્યની જેમ (ગીરી જશે) પ્રકારી જશે.

માણસ, બાઈ, નાના, મોટા, યુવાન અને વૃદ્ધ સંઘળાં મારાં
રૂહાની ફરજીઓ છે. હું જ્યારે ય ભૂલતો નથી; અને ન જ્યારે ય ભૂલીશ.
દુનિયામાં પણ અને આજેસમાં પણ.

તમારાં બાળજોને શિક્ષાગ અપાવવાની કોણિશ કસા રહેજો.
યુરોપીય ભાષાઓ અને અંગ્રેજી શીખવવા માટે તત્પર રહેજો. તમારા
સમયના હક્કેમો (સત્તાધારીઓ)ના હુકમ માનજો. નાના અને હાથ
નીચેનાઓ ઉપર મહેરબાન થઈ રહેજો.”

—હજસન ઈમામ સુલતાન મુહમ્મદ શાહ (અ.સ.)નું ફરમાન

અનુવાદક તરફથી બે બોલ

આ પુસ્તક દેખાવમાં નાનકડું છે કે જેને વાંચી જવામાં વધુ સમય ન લાગે, પણ તેને જો ઊડાગથી જોવા જઈએ, તો આ એક જ્ઞાનનો સમુક્ત છે કે જેને એક કુળજીમાં બંધ કર્યાનો પ્રયત્ન કરીને લેખકે ખરા અર્થમાં વાંચનાર માટે ધ્યાન બધું આપી દીધું છે. લેખકની વિદ્વતા, જ્ઞાન અને વ્યવહાર જ્ઞાનની સાંદર્ધના સુમેળથી પ્રભાવિત થઈએ, આંતરરાષ્ટ્રીય ઘ્યાતિ મળેલ હેવા ધ્રાં નમૃતાના ગુરુઓ ધરાવનારા આ માનવી તરફ આકષ્માઈને, આરંભમાં જે ઇન્ફો મિન્ડબાવે અને ગુજરાતી લેખન-વાંચના રોખને લીધે અનુવાદ કર્યા ખાતર કે પદ્ધતી ગુજરાતી વાંચકો માટે કંઈક સાદું વાંચન અને જ્ઞાન મળે એ હેતુથી અલ્લામા નસીરુદ્દીન હુંઝાઈના પુસ્તકો “સો-સવાલ” અને “ઝીકરે-ઇલાહી” નો અનુવાદ કર્યો હો. તે હવે જ્ઞાસા અને જ્ઞાનવૃદ્ધિની અનાયાસે મળેલી તક માટેની લાલસાનું સ્વરૂપ ધારણ કરતો જાય છે; અને આ પદ્ધતી પણ તેમના બીજાં પુસ્તકોનો ગુજરાતી અનુવાદ કર્યાનું કામ ચાલુ રાખવાની વૃત્તિ થાય છે.

એ વાતમાં ક્રેચ શંકા નથી કે લેખક પાસે જ્ઞાનનો ભંડાર છે, પણ તેમના પુસ્તકો આપણા ઈન્ફો-પાકના ગુજરાતી ભાષાઓ માટે સમજવામાં થોડો સમય લાગશે. કારણ કે તેમના પુસ્તકો કુરાનના હવાલાથી ભરેલાં છે અને આપણો પીરોના ગીનાનો તથા ઈમામના ફરમાનો ઉપર મુખ્યત્વે ભાર મૂક્ણા હોઈએ છીએ. જેથી કરીને સંભવ છે કે એવાં પુસ્તકો કે જેમાં આ બે વસ્તુ ન હોય તેને આપણે ગંભીરપણે ધાર્મિક ભાવનાની અસરથી નથી જોતા, ધ્રાં ય લેખકના

પુસ્તકોમાં ઈમામ તરફના પ્રેમ, વિશ્વાસ અને ભાવના થકી, તેમના ઉચ્ચ રૂહાની અનુભવો થકી અને કુરાને શરીરફના જ્ઞાનની તેમના દ્વારા અપાતી સમજાગ થકી તેમનાં પુસ્તકો અગત્યતા ધરાવે છે; અને ન ફરજ વાંચવા યોગ્ય છે, પરંતુ મનન કરવા લાયક છે. જેને ક્યાંયથી પણ કંઈક સારું મેળવવું જ હોય, તને તો આમાંથી ઘણું બધું મળી રહે છે.

પંજેતન પાક તથા પાવિત્ર ઈમામોનાં નામોની છિકમત તથા તેના અર્થના વર્ગન દ્વારા આહી આ પુસ્તકમાં આપેલી બાબતો વિશે વધુ વિગત આપવા, કરતાં એટલું જાગ્રાવવું જ પૂરતું થઈ પડ્યો કે આ પુસ્તક એ સ્વાદ ચખાડે છે કે જે સ્વાદથી અન્ય ક્રેદિ જો નહિ હોય તો હું તો અજાગ હનો જ; અને આ સ્વાદ ચખવાથી અનેરો આનંદ મળ્યો કે જે વારંવાર માણવાને મન થાય છે.

**Institute for
Spiritual and
Luminous Sciences**

—અકબર છબીબ રાજીન
મ્યુનિયાર્સ, જુલાઈ, ૧૯૮૦

Knowledge for a united humanity

બિસ્મિલ્હાહિર રહ્માનિર રહીમ

આ નમ્ર અને કમજીર બદ્દો ઈમામે જ્રમાનના ગુલામોનો ગુલામ, મિત્રોના પગની રજ, મજકૂર ખાસ વિષયના રૂપમાં મારા અમૃક ઉચ્ચ મુકામી, અક્ષલમંદ અને જ્ઞાન ધરાવનારા મિત્રોની લેખિત કરમાઈશના અમલ માટે પ્રયત્ન કરી રહ્યો છું જેમાં તેમણે ઈલમના ઝેલાવા ખાતર, પવિત્ર અહેલેલેત સત્ત્વાતુલ્લાહ અહેલિમના મુખાર્જનામોના અર્થ અને તેની છિકમત (તેના જ્ઞાન)ને વર્ગવવા માટે કહેલું. તો ખૂબ જ આજુજુપૂર્વક વિનતી છે કે આ વિષયમાં સૌથી પ્રથમ તરસીએ અથડતિ નામ પાડવા વિશે કંઈક મૂળભૂત વાતોની ચર્ચા કરવી જરૂરી છે, જે નીચે મુજબ છે :

૧. ધાર્યી વખત સ્વિયત અથવા સ્વિઅ અથવા મજહબી માન્યતા મુજબ લોકો પોતાનાં બાળકોનાં નામ ક્રેચ દીની (ધાર્મિક) અથવા ખાનદાની બુર્જ અથવા ક્રેચ જ્ઞાગીતી કે પ્રખ્યાત વ્યક્તિના નામ ઉપર રાખે છે; અને આમ કરવાનો હેતુ અને ઈચ્છા એ હોય છે કે ખુદા કરે ને ક્ષાય તેમનું બાળક જેનું નામ (જે વ્યક્તિના નામ ઉપરથી રાખેલ છે) તેના જેણું થઈ જાય.

૨. જે યોગાનુયોગ (ઇન્ટેફાન્સ) ક્રેચ ઉચ્ચ હસ્તીનું નામ શબ્દે શબ્દના અર્થમાં (ક્રીલનરીમાં જાગ્રાવ્યા મુજબ) સામાન્ય એટલે કે મામુલી પ્રકારનું છે, તો તેમ છાં પાગ સૈંક્ષાંતિક રીતે વ્યક્તિગત ગુગ્યોને દૃષ્ટિ સમળ રાખીને ખૂબ શોખથી એવાં નામ પસંદ કરી લે છે, જેમ કે હજસ મૂસા અહેલિસસલામનું બરકતવંતુ નામ છે. જેકે શબ્દ “મૂસા” જાહેરી રીતે પોતાની મૂળ એટલે કે “કીલી” ભાષામાં સામાન્ય અર્થ ધરાવે છે. જેમ કે “મૂ” નો અર્થ છે પાણી; અને “સા”નો અર્થ

વૃક્ષ (દરખા) છે. મતલબ કે “મૂસા” એટલે વૃક્ષની નીચે પાણીથી લીધેલું. તે છાં તેમાં ક્રોઈ રંકા નથી કે બરક્ક મેળવવાની નિયતથી આ મહાન પયગમ્બર એટલે કે મૂસા (અ.સ.) માં નામ ઉપર રાખવામાં આવે છે, કેમ કે આ દેશાંતમાં નામના શાબ્દિક અર્થ ઉપર વ્યક્તિની ખાસિયતો અને ખૂબીઓ સરસાઈ મેળવી જાય છે.

૩. આ બાબતમાં એક સ્વિબ્જ એ પાગ છે કે નવજન્મિત બાળક માટે ક્રોઈ એટું નનું નામ કે જુનું નામ પસંદ કરવામાં આવે કે જેના અર્થમાં બાળક કે બાળકી માટે ક્રોઈ સારો ગુણ સમાયેલો હોય, જેમ કે “શોરદીલ” અને “આજીતાબ બાનુ”

૪. ધારીવેળા બાળકનું નામ સ્થળ, જગ્યા અને અન્ય બનાવોના હવાલાથી રાખવામાં આવે છે, જેમ કે “નવરોજાયલી”, “ગુલરાન” “હજજબીબી” વગેરે. તેમ છાં સૌથી ઉત્તમ બાબત એ છે કે મોમેનીન પોતાના બાળકનું નામ અહેલેભેત અલૈલિસસલામના મુખાએ નામો ઉપરથી રાખે, અને હા ! બાળકીઓ માટેનાં નામો માટે અલબત એ રજા છે કે સિતારાઓ, જવાહિરાત, કૂલો વગેરે જેવી દિલકરા વસ્તુઓમાંથી ક્રોઈ નામને પસંદ કરે.

જો કે આહેરી રીતે તો માનવંત અંબિયાઓ અને ઇમામો અલૈલિમુસસલામના મહાન નામોમાં પાગ એ જ સિદ્ધાંત કામ કરી રહેલા દેખાય છે. પસ્તુ ખુદા તથાલાની નણક રહેના બંદાયોની છેસિયતથી તેઓ માનવંતનાં મુખાએ નામોમાં ઇંત્મ અને મારફતના મોટા મોટા ભેદે ધૂપાયેલા છે, તો એ બાળતમાં કંઈ અજ્ઞાયબી નથી કે અલ્લાહ તથાલાએ હજસ મૂસાના નામમાં પાગ એક ખાસ તાવીલ સમાવી દીધી હોય. કેમ કે તાવીલનું જ્ઞાન પોતાની મીકારા અને સુરની

શાન્તિમાં પાણી માફક છે અને શબ્દો જુદા જુદા પ્રકાસના વાસણું જેવા છે, માટે તાવીલનું પાણી દરેક શબ્દના વાસણમાં તેના સ્વરૂપ મુજબ સંદર્થી મોજૂદ રહ્યા કરે છે. હવે આપણે આ ઓળખાંગ (પ્રસ્તાવના) પછી મૂળ વિષયની તરફ પાછા વળીએ છીએ.

મુહમ્મદ (અ.સ.) : આ શબ્દનું મૂળ હુએ-મીમ-દાલ" છે. મુહમ્મદનો અર્થ છે આતીરાય વખાંગેલું પ્રસાંસા પામેલું. કુરાને પાકમાં "મુહમ્મદ" શબ્દ ચાર વખત આવ્યો છે; અને અહેમદ એક વખત ક્રેવાયેલો છે. આમ તો પૂરું કુરાન રહેમતે આલમ સલખાહુ અલૈહિ વ આલૈહિ વસ્તુમની પ્રસાંસા અને ગુર્ગેથી ભરેલું છે. જેમ કે ક્રેવામાં આવ્યું છે કે "કુરાન તમામ વસ્તી કમલી મુહમ્મદ અસ્તા" અર્થાતિ "કુરાન સંપૂર્ણપણે મુહમ્મદની કમાલીયતનાં વખાંગ છે." પરંતુ અહીં ક્રતા નામ "મુહમ્મદ"નો અર્થ એ જ આપણો હેતુ છે. માટે એ ક્રેતું વાજિબ છે કે આ શબ્દનો સીધેસીધો સંબંધ "મુજામે મહેમ્મદ" (અર્થાતિ વખાંગેલી જગ્યા)થી છે. જેમ કે ખુદાનું ઇસ્માન છે કે "અંધ્યાલાસાક સ્થબુક મુજામન મહેમ્મદન" ૧૭/૭૮. "સંભવિત છે (દૂર નથી) કે તારો પરસ્યાદિગાર તને મુજામે મહેમ્મદ (વખાંગેલા સ્થળો) પર પહોંચાડી હો." અર્થાતિ તમારું પુનર્જીવન મુજામે મહેમ્મદ પર હો, જે હિંદ્ય, (ઈંદ્યરી) શબ્દ અને બુદ્ધિનું મૂળ છે, જે પ્રસાંસા પામેલ અને વખાંગાયેલ છે.

મુહમ્મદની સંખ્યાવાચક (NUMERAL) તાવીલ "અલી" છે. તે એ રીતે કે મુહમ્મદ : મીમ (૪૦) + હ (૮) + મીમ (૪૦) + દાલ (૪) = ૮૨ = ૮ + ૨ = ૧૧ = ૧ + ૧ = ૨; જીવાબ "અલી" = એન (૩૦) + લામ (૩૦) + યે (૧૦) = ૧૧૦ = ૧ + ૧ + ૦ = ૨. જીવાબ તમો જોઈ રાકો છો કે અકસેની વધુ ગાગતરી (જુમલે

અસગર) ‘૨૦ છે, જેનો હેતુ (જેનાથી પુરાણ) છે અલી. કેમ કે અલીના અકસ્મેની વધુ ગૃહિતરી પણ ‘૨૦ છે. આનો અર્થ એ થયો કે મુહૂર્મદ અને અલી સલવાતુલ્હાઓ અદૌદિમ એક જ નૂર છે. એ માટે કે નૂર સદા ય એક જ હોય છે. તેજ એક નૂર સર્વત્ર, સર્વવ્યાપક અને પૂર્સું છે; અને બે નૂરની કૃત્પનાથી નૂરની કમાલીયતનો અસ્વીકાર (નામંજૂરી) થાય છે.

મુસ્તકઃ : આનું મૂળ સ્વાદ, કે વાવ છે; અને તેનો અર્થ છે ચૂંટાયેલું પસંદ કરેલું, કિમત કરાયેલું, વખાળાયેલું; અને એ આપ હજસન (સ.અ.)નો લક્ષણ-સંજ્ઞા મુખારક છે.

અલી : મૂળ છે એન, લામ, યે, મતલબ છે ઉચ્ચય (બુલંદ), ઉન્નતિ, આઈશ, ગૌર્બ પામેલું. ‘અલી’નું આ બરજન વંતુ નામ ખુદા તથાલાનાં ગુરુવાચક નામોમાંથી છે, જેનું કાસગ એ છે કે અલાહ પાક પોતાના પસંદ પામેલા બંદાઓ (અંબિયા અને ઈમામો)ને પોતાની દ્યાવાળી આકૃતિ, (સ્વરૂપ) સૂસે રહેમાની ઉપરથી પૈદા કરે છે, પોતાનું ક્રેચ નામ આપે છે, પોતાના જીવંત ઈસ્મે આજમ તરફ નીમે છે, પોતાની પવિત્ર રૂહ તેમાં ફૂકી દે છે; અને પોતાની જિલાઝતથી તેને નવાજે છે (મોટી પદ્ધતી આપે છે); તો આ સત્ય છે કે મુહૂર્મદ (સ.અ.સ.) અને અલી (અ.સ.)નાં પવિત્ર નામો ખુદાના તરફથી બજાવામાં-ઈનાયત કર્યામાં આવ્યાં છે. કેમ કે આ તેનો એક દૃઢ-અટલ નિર્ધાર હો કે નૂરે ઈસ્મ અને છિદાયત હમેશા માટે ઈદ્વાલીમ (અ.સ.)ની આલ સાથે જોડાયેલા રહેશે. (૪ : ૫૪)

મુનુર્ગા : મૂળ રે, જવાદ, યે છે. આનો અર્થ છે પસંદગી પામેલું કીમતાં, ચૂંટી કાઢેલું પ્રઘ્યાત. આ મૌલા અલી (અ.સ.)નો

લકબ છે, જે ખુદા અને રસૂલ (સ.અ.સ.)ની ઈરણા મુજબ છે.

શતમા : મૂળ છે કે, તોય, મીમ. શતમાનો શબ્દ મુજબનો અર્થ (લુગવી માયના) છે, “તે સ્વી જોગે નક્કી કરેલા સમય ઉપર બચ્ચાનું દૂધ છોડાવ્યું હોય.” પરંતુ (જનાબે સૈયદા સલામુલ્લા અલેહા) હજરત બીબી શતમાનું આ પવિત્ર નામ શતમા બિન્ને અસદના ઉચ્ચ નામે રાખવામાં આવેલ છે; અને તેમાં શાબ્દિક અર્થ કરતાં હજરત અભૂતાલિબની ધર્ત્વાળી શતમા બિન્ને અસદના વ્યક્તિત્વના ગુણો સામે રાખેલું છે. તેઓ અસદની મુત્રી, હજરત હાશિમની પૌત્રી અને રસૂલુલ્લાહ સલ્લાહુ અલેહી વ આલેહી વસસલમની ફૂઈ હતાં, તેમનામાં શું શું ગુણો હા (ખૂબીઓ હતી) અને તેઓ હજરત રસૂલ સલમની માવજત બાબત કેટલી મહોબ્બત અને માયા સાથે સારસંભાળ કરી છે, તે બાબતની જાણ સંબંધિત ઈતિહાસ દ્વારા થઈ શકે છે.

ઝરા : મૂળ જે, ઝ્યુ, રે, છે. અર્થ છે ઝગમગતું, ચમકતું, પ્રકાશિત, ચક્કાશિત, ઝહર, દીવા અથવા ચંદ્રને અથવા ચહેરાના પ્રકાશિત થવાને કે ચમકવાને કહે છે. અઝહરના પણ એજ અર્થ થાય છે, પણ તે નરજીતિ માટે છે. આજ મૂળ સાથે એક અન્ય શબ્દ ‘ઝોહરા’ છે, જેના અર્થમાં રૂપાળાપણું, સૌર્ય સમાયેલ છે. એ જ ઝોહરા એક ગૃહ-સિતારો છે, જેને અમુક જૂના લોકોએ રૂપ-સૌર્યની દેવી માની છે. ટૂંકમાં કહીએ તો શતમા ઝરા સલવાતુલ્લાહ અલેહાની પવિત્ર અને પાકજાત વ્યક્તિત્વમાં તે દેખ ખૂબીઓ અને ગુણો મોજૂદ હાં, જે જનતની સીઓની એક સરદાર સીમાં હોવા જોઈએ. તેઓ બુદ્ધિમાં રૂહાની અને જીસ્માની રીતે અત્યંત પાક અને પવિત્ર હતી, કેમ કે ખુદાવદે આલમીને આયતે તત્ત્વીરમાં રસૂલ (સ.અ.વ.)ની અહેલેબેત

(ખાનદાન)ની પૂરેપૂરી અને સંપૂર્ણ પવિત્રતા અને પાકીજીઓની જામીનગીરી આપી છે. “આ દુનિયામાં ભૌતિક ચીજોની પવિત્રતા કેટલી ય રીતોથી થાય છે, પાણ સૌથી ઉત્તમ પવિત્રતા સૂર્યના કિરણોથી અને બીજા તબક્કાની સફાઈ પાણીથી થાય છે. જ્યારે પાણી સમુદ્ર સુધી પહોંચતાં પહોંચતાં મેલું થઈ જાય છે, મિશ્રાગવાળું થઈ જાય છે, તો સૂર્ય તેને પાતળું અને પવિત્ર બનાવીને જાપાડી લે છે; અને પવિત્ર પાણીના રૂપમાં ફરી વાર વરસાવી હે છે.” (૩૩ : ૩૩) (૨૫ : ૪૮). આ દેણાંતથી એ સત્ય જાહેર થઈ જાય છે કે અહેલેબેતની પવિત્રતા નૂરના વરસાદથી થયા કરે છે, જે સૌથી ઉચ્ચ તબક્કાની પવિત્રતા છે.

હસન : મૂળ જ્ય, સીન, તુન છે. તેનો અર્થ થાય છે દેખ્યે ખુશ કલ્યાર, મનગમતી વસ્તુ ખૂબસૂસ, રૂપાળી ચીજ. હજસન નથી સાહેલનું ફરમાન છે કે “અથ હસનુ વલ હુસૈન ઈમામા છક.....હુમા જેર.” હસન અને હુસૈન બંને બરષ્ણ (ખરા) ઈમામ છે. પછી તેઓ જાભા થઈ જાય કે બેસી જાય; અને તેમના પિતા બંને કરતાં બહેલર છે. મતલબ કે હજસન હસન (અ.સ.) અને હજસન હુસૈન (અ.સ.) ભલે દાવત કરે કે ન કરે, તેઓ ઈમામે મુસ્તવદા અને ઈમામે મુસ્તકર છે; અને તેમના પિતા તેમનાથી ઉચ્ચ છે. એ માટે કે તેઓ અસાસ છે.

જ્યાં ઈમામે બરષ્ણ (ખરા ઈમામ)નું નામ ‘અલી’ છે, ત્યાં નૂર ખુદાની જાયાઈની તરફ ઈશારે ફરમાવેલ છે; અને જ્યારે આ નૂર હસન (અ.સ.)ના સ્વરૂપમાં છે, ત્યારે તેના બાળની રૂપ અને સુંદરતા તરફ ધ્યાન દેખવામાં આવેલ છે. હજસન યુસૂફ (અ.સ.) ઈમામે

મુસ્તવદા હાં, જેને સર્વજ ખુદાવદે નૂરે ઈમામતની રૂહાની સુંદરસા અને શાનો-શોકના દેણાંત બનાવીને રજૂ કરેલ છે, જેથી ઈમાનવાળાઓના હીકી ઈચ્છાનું જોર ગમટે.

હુસૈન : મૂળ હ્ય, સીન, તુન છે. આનો અર્થ પાણ એ જ છે જે હસન શબ્દનો છે, પાણ આમાં ફક્ત શાલિક કેરફાર એટલો છે કે આ ટૂંક નામ છે. જે ઘારની ભાષામાં છે. ઘારને લીધે બોલાય છે. આ હિકમતસભર નામ થકી ઈશારો એમ છે કે કંઈક લોકો આલે નબી ઓલાડે અલી (અ.સ.)ને તુચ્છ સમજશે અને કંઈક લોકો તેમનાથી ઘાર કરશે. કેમ કે ટૂંક નામની આજ બે બાજુ હોય છે.

ઝેનુલ આબેદીન : જે, યે, તુન અને એનું બે દાલ મૂળ છે. આપ (અ.સ.)નું મૂળ નામ અલી હતું; અને ઝેનુલ આબેદીન લકબ હતું. એનો અર્થ છે ઈબાદત ગુઝારેનું આત્મભૂષણ (શાગગાર). ઉચ્ચ મુકામી ઈમામ (અ.સ.)ના આ મુખાસ્ક લકબ થકી એક જ ખુદાની ઈબાદતની મહત્વતા જાહેર થાય છે. સાથે સાથે એમાં એ સંકેત પાણ છે કે ઈબાદતની રૂહ ઈમામતની કલ્પનામાં છે. કેમ કે ઈમામે ઝમાના જ મારફતનો દરવાજો હોય છે અને મારફત ઈબાદતની જાન છે. કુરાનમાં “ઝેન” શબ્દ નૂરે ઈમાનના માટે આવેલ છે. જેમ કે ફરમાવ્યું છે કે “...કુલુનિકુમ...૪૮/૭. પરંતુ અલ્લાહે ઈમાનને તમારા માટે પ્રિય બનાવ્યું છે અને તે (ઈમાન)ને તમારા અંતઃકરણોમાં શોભાયમાન કરી રાખ્યું છે.”

મુહમ્મદ બાકર : આનું મૂળ છે બે કાઢ, રે. “બફરત” = ફાડવું ખોલવું, વિરાળ કરવું. “ભબકરા અર-રજૂલુ ફી-અલ ઈલ્મ વ ફી-અલ માલ” = કોઈની પાસે પુષ્ટણ જાન (ઇલ્મ) હોવું અથવા

અતિશાય માલ-ધન હોવો. અસલ શબ્દો મુજબ બાકસનો અર્થ છે, ધૂપા જ્ઞાન અને (આંતરિક) ગુમ બાળનાનો બોલનાર (જાહેર કરનાર). એ જ કારણે આપ (અ.સ.)ને બાકીનું ઉલ્લૂમ કહેતા હા. ટૂંકમાં એ કે આપ (અ.સ.)ના નામ અને કામના નમૂનાથી (દેશાંતરી) એ સ્પેષ્ટ થઈ જાય છે કે તુરે ઈમામત હમેશાં ગુમ અને જ્ઞાન વિશેની (ઇરખાની) હિકમતોને જાહેર કરતું રહે છે.

જાહેર અસ્સાંદ્રિકિ : મૂળ જીમ, એન, કે અને સાંદ, દાલ કાંદ છે. જાહેરનો અર્થ છે દસ્તિયા (સમૃદ્ધ), નદી; અને સાંદ્રિક સત્ય બોલનાસ્ને કહે છે. આ મુખાચ નામથી એ હીકન સ્પેષ્ટ થઈ જાય છે કે મહાન અને પાક ઈમામ હીકી ઈત્તમ-જ્ઞાનનો વહેતો દસ્તિયો હોય છે. પ્રત્યેક ઈમામ પોતાના સમયનો “અસ્સાંદ્રિકિ” હોય છે અને સંઘળા માનવંત ઈમામો “સાંકેન” કહેવાય છે, માટે દરેક જમાનાના લોકોને ફરમાવવામાં આવ્યું : “ચા અચ્યુત્ખલગ્રીના આમનુ.....”/૧૧૮ “અય ઈમાન લાવનારાઓ ! અલ્લાહથી ડસ્તા રહે અને સાચાઓનો સાથ આપો.” મતલબ કે પોતાના સમયના ઈમામની સાથે થઈને રહે, જેથી તમોને સત્ય અને માર્ગનું (જ્ઞાન)ના ભંડારથી માલામાલ કરી દેવામાં આવે. જો તમો ઈથ્યો તો અહી ખૂબ વિચાર કરી શકો છો કે એક તરફ સંઘળા ઈમાનવાળા છે, જેમને હીકી ઈમામ અને પરહેઝગારીથી કામ લઈને સાચાઓની સાથે થઈ જું જોઈએ. બીજી તરફ સાચાઓ છે, જેઓ ઈમાન, પરહેઝગારી અને સચ્ચાઈના ઉચ્ચ દરજજા ઉપર જિભેલા છે.

ઇસ્માઈલિસ : હિન્દુ ભાષામાં આ શબ્દ “શીમાઈલ” છે. ‘શીમા’ (સમાચ) સાંભળવું અને ‘ઇલ’ અલ્લાહ. શાંદ્રિક અર્થ થાય છે

ખુદાનું સાંભળવું ઈમામે બરજીકનું આ બરજનવંતું નામ હજસા ઈભાહીમ (અ.સ.)ના નેક ફરજાં હજસા ઈસ્માઈલ (અ.સ.)ના નામ ઉપર છે. આ છિકમતસભર નામમાં એ ઈશારે દેવામાં આવ્યો છે કે ઈમામતનો સિલસિલો આલે ઈભાહીમ (અ.સ.) અને આલે મુહમ્મદ (અ.સ.) છે. આનાથી જહેરી અને બાતિની કુરબાનીઓ તરફ ધ્યાન દેસ્વવામાં આવ્યું છે.

મુહમ્મદ બિન ઈસ્માઈલ : પવિત્ર ઈમામ (અ.સ.)નું આ મુખાચ નામ પયગમ્બરે ઈસ્લામ (સ.અ.વ.)ના મહાન નામ ઉપર છે, જેથી આલે મુહમ્મદના ઈમામોનું નૂરાની અને ખાનદાની સંબંધ-સગપણ લોકોની જ્ઞાગમાં રહે. ખુદાવદે આલમે પોતાના વહાલા પયગમ્બરે ઈસ્લામ (સ.અ.વ.)ને ક્રોસર ૧૦૮/૧ એટલે કે એવો પુરુષ અર્પણ કર્યો, જેના અગ્રણિત બાળકો છેય અને તે ચોક્કસપણે મૌલા અહી (અ.સ.) છે. જેથી સ્યુલુલાહના ધ્યારા દીન (ઇસ્લામ)ની છિદ્ધાયતની વ્યવસ્થા (છિદ્ધાયતનું કામ) સંઘને માટે ટકી રહે. આ રીતે અમીરુલ મોમેનીન (અ.સ.)ના ઉચ્ચતમ ગુગવાળા વ્યક્તિત્વમાં ક્રોસસનો ગૂડ અર્થ દ્યુપાયેલો હો. ક્રોસસનો બીજો અર્થ છિકમત છે, જેમાં પુષ્ટ ભલાઈ છે. ૨/૨૬૮; અને તેનો ગ્રીજો અર્થ હોજે ક્રોસર છે; અને આ સર્વે હ્કીકી નૂરે ઈમામતમાં દ્યુપાયેલા છે. હોજે ક્વસસ્ની તાવીલ ક્યામતના મહલબાની છે, જેનો માલિક દરેક સાતમો ઈમામ છેય છે. આ રીતે હજસા ઈમામ મુહમ્મદ બિન ઈસ્માઈલ સાત સાત ઈમામોના નાના નાના વર્તુળોના સંબંધેના પ્રથમ સાહેબે ક્યામત હા. એ જ કાસરણ છે કે આપ (અ.સ.)માં નૂરે ઈમામત અસાધારણ રીતે બદલી થયો હતો.

વહી અહેમદ : મૂળ વાવ, કે, યે, અને છ્ય, મીમ દાલ. વહી = સંપૂર્ગ, ખૂબજ વક્ષાદાર, છ્ય દેનાર અને છ્ય લેનાર. અહેમદ = ધારું વખણાયેલું પ્રસંગા પામેલું જેણી ધ્યાણી તારીઝ કરવામાં આવેલી હોય. અહી અહેમદ એ રસૂલ સાથમનું પવિત્ર નામ છે; અને એ મુજબ વહી અહેમદનો અર્થ છે હજસન પયગમબરસ(સ.અ.વ.)ના તરફથી છ્ય લેનાર અને છ્ય દેનાર; અને ખૂબ જ વક્ષાદારી કર્ણાર. આ બરકતવંતા નામથી એ છ્યક્રિન સ્પષ્ટ થઈ જાય છે કે ઈમામે બરછ્ય ખૂદા અને રસૂલ (સ.અ.વ.)ના તરફથી હોય છે. અતે એ યાદ રહે કે ‘વહી’નો ગુગ-સિક્ષન ‘વક્ષા’ ધારું મોટે છે. તેનું દીટાં એ છે કે અલ્લાહ તથા લાયે હજસન ઈખ્રાહીમ (અ.સ.) જેવા મહાન પયગમબરનાં સંઘળાં જાહેરી અને બાતિની પરાક્રમો તથા જ્ઞાન અને મારણતનાં વખાણ આજ એક શબ્દમાં ફરમાવેલ છે, તે એમ છે કે “ઈ ઈખ્રાહીમખાહી વક્ષા”—અને ઈખ્રાહીમના (સહીકાની) પણ કે જેણે (તાબેદારીનો છ્ય) સંપૂર્ગ (રિત) બજાવ્યો. (સહીકા = લેખ)

તકી મુહમ્મદ : મૂળ વાવ, કાદ, યે. તકી = ખૂદાથી ડરીને ચાલનાર, સદાચારી, પરહેઝગાર. અહી એક વાત ઉલ્લેખનીય છે કે નૂરે ઈમામત સદાકાળથી એક જ છે. કંન એનાં જાહેરી નામ અને શરીર જુદાં જુદાં હોય છે, જેથી દરહક્કીકન એક નામના નામમાં જે અર્થ સૂચવનારા ઈશારા છે તે સંઘળા ઈમામો વિરો જ છે. જેમકે તકી મુહમ્મદ (મુહમ્મદ સ.અ.વ.નો (મુતકી) પરહેઝગાર). જેકે એક ઈમામનું નામ મુખાસ્ક છે, પણ આ શબ્દનો અર્થ સંઘળા ઈમામો અલૈહિમુસ્સલામમાં એકસરખી રિતે (સંબંધ ધરાવે) છે. વળી અહી એ પણ યાદ રહે કે તકવા (પરહેઝગારી) જેનું કુરાન અને ઈસ્લામમાં

ધર્મનું જ મોટું મહત્વ છે, તે મહાન મસ્તબો રાખનાર ઈમામો (અ.સ.)ના વ્યક્તિત્વથી સંબંધ રાખે છે.

રજી અભુલ્લાહ : મૂળ રે, જવાદ, યે અને અયન, બે, દાલ..

રજી અભુલ્લાહ : ખુદાનો એ બંધો જે સંતોષી છે, રજી છે. ઈમામ અલૈહિસ્સલામના આ પવિત્ર નામનો વિષય રજા અને રીજવાનુલ્લાહ અર્થાત ખુદા તથાલાનો રજીપો-તૃપ્તિ છે. કેમકે દીને ઈસ્લામમાં ખુદાવંદનો રજીપો-રજા-સૌથી મોટી વસ્તુ છે. એનો અર્થ એ થયો કે (ખાસાને ઈલાહી) ખુદાના પસંદ કરેલાઓ ઈબાદત અને તાબેદારી ન તો દોગ્ફના ઉરથી કરે છે અને નહિ તે બહિસ્તની ઈચ્છાથી કરે છે, પરંતુ અક્ષાહ તથાલાનો રજીપો મેળવવા માટે કરે છે; અને તેઓ દરેક હાલમાં ખુદાની ઈચ્છા (રજા)માં રજી-ખુશ રહે છે. કુરાને હકીમ કહે છે, “એ મીનાસી મંચ્યસારી.....” ૨/૨૭. “અને લોકોમાંથી (ક્રીએ) એવો (પણ) છે જે અક્ષાહની ખુશી સંપાદન કર્યા (માટે) પોતાનો જીવ પણ વેચી નાખે છે; અને અક્ષાહ સર્વે બંદાઓ ઉપર માયાળુ છે.” મજફૂર આયતે કરીમાની ખાસ અને સામાન્ય બે બાજુ છે. એની ખાસ બાજુ એ છે કે આ અમીરુલ મોમનીન અલી અલૈહિસ્સલામની શાનમાં (હિજસ્તની રાત્રે આપ (અ.સ.) નબી સાહેબના બીજાના ઉપર તેમની આજાથી દુશ્મનોના ઘેરા વચ્ચે પોતાની જાનના જોખમે સૂઈ રહ્યા હતા ત્યારે જીતરી) છે; અને સામાન્ય બાજુ એ છે કે આમાં દરેકના માટે હિદાયત છે કે જેથી એ સમજી લેવામાં આવે કે ખુદાનો રજીપો મેળવવા માટે મોટામાં મોટી કુર્ખાની પણ હેવી પડે છે.

મુહમ્મદ મહેદી : મૂળ હ્ય, દાલ, યે. મહેદી = હિદાયત

મેળવેલ (હિંદાયતનો માલિક), એ માનવી જેને અખાહ તથાલા હક-સર્વાઈ તરફ માર્ગદર્શન કરે. ઈમામ અલેહિસ્સલામ આ મુખાચ નામનો વિષય છે. હિંદાયત અને તેનો ખુલાસો એ છે કે પ્રત્યેક ઈમામે બરહક સર્વપ્રથમ મહેદી (હિંદાયત મેળવેલ) છે અને તે પછી હાદી (માર્ગદર્શક) છે. જોકે સધળા પવિત્ર ઈમામો (અ.સ.) બાતિની ગુરુના હિસાબે એક જેવા છે, એમાં ખુદાઈ પ્રોગ્રામ મુજબ અમુક ઈમામોના વખતમાં મોટા મોટા બનાવ્યે બને છે. જેમકે હજરત ઈમામ મુહમ્મદ મહેદીના વખતમાં બન્યું હતું.

કાયમ બિ અસ્ત્રિલાહ : કાદ, વાવ, મીમ અને અલીદ, મીમ રે મૂળ છે. કાયમ બિ અસ્ત્રિલાહ નો અર્થ છે, તે શખ્સ જે ખુદાના હુકમથી દીનના કાજે જલ્દો થયો હોય, જે ઈશ્વરી સતાનો-હુકમનો માલિક, દરેક અધિકારનો સાહેબ, જે ઈમામ અલેહિસ્સલામ છે. જેમ કે અખાહ તથાલાનું કરમાન છે, “શાહીહુદ્દાહ ઈન્નાહ લાઈલાહ ઈલ્હા ઝુવલ.....૩/૭૭.” અર્થ : અખાહ (પોતે) સાક્ષી આપે છે (જાહેર કરી દીધું છે) કે તેના (પોતાના) સિવાય અન્ય કોઈ પૂજ્ય (ઇબાદતને લાયક) નથી; અને તે (સર્વ સૂદિને) ન્યાયથી કાયમ રાખી રહ્યો છે. (તેવી જ સાક્ષી) સધળા કરિસ્તાઓ તથા જ્ઞાનીઓ (અંબિયા અને ઔલિયાઓ) પણ પૂરે છે.” મજફૂર પવિત્ર આયતમાં તૌહીદ (અખાહ એક હોવા વિશે)ની સાક્ષીમાં ખુદા અને કરિસ્તાઓ પછી જેઓનો ઉલ્લેખ કરવામાં આવે છે, તેઓ અંબિયા અને ઈમામ અલેહિસ્સલામ છે, જેઓ જ્ઞાનીઓ છે; અને પોતાના સમયમાં અદલ-ઇન્સાઇ ઉપર કાયમ છે. માટે હજરત ઈમામ કાયમ બિ અસ્ત્રિલાહ (અ.સ.) ખુદાના હુકમથી રૂહાની જ્ઞાન અને ન્યાય કાજે જલેલા હતા. રૂહાની જ્ઞાન અને ન્યાયની

વહેયાગું કસનાર હતા; અને પ્રત્યેક ઈમામ એવા જ હોય છે.

ખુદાઈ નૂરનો દીવો સદાકાળ માટે પ્રકાશિત છે. તે કઢી બુજ્જો નથી. તેનો અર્થ એ છે કે જ્ઞાન અને માર્ગદર્શન (હિદાયત)નો આ દીવો એક પરંપરા (સિલસિલા)માં કાયમ છે. આ પરંપરા નબુદ્ધતના સમયમાં અંભિયાઓ ઉપર અને ઈમામતના સમયમાં પવિત્ર ઈમામો ઉપર રચાયેલી છે; અને એ જ પાક અને પવિત્ર પરંપરાની પવિત્ર વ્યક્તિઓ જ્ઞાનીઓ વંશ જ છે, જે ન્યાય ઉપર કાયમ છે. એથી વિરુદ્ધ જો ક્રોછ સમયમાં જ્ઞાન અને ન્યાયનાં ઘણાં સાધનો એકી સાથે મોજૂદ હોત અને અન્ય સમયમાં ક્રોછ વસીલો (સાધન) ન હોત, તો એવા સ્વરૂપમાં ખુદાનું ઈત્તમ-જ્ઞાન સધણા સમય ઉપર છ્યાયેલું ન હોત; અને તેના ન્યાયમાં ભૂલ જીભી થઈ જાત. પરંતુ એમ નથી.

મનસુર બિલાહ : મૂળ નૂર, સ્વાદ, રે. મનસુર બિલાહ = તે શખ્સ જેને ખુદ તરફથી મદ્દ મળી ગઈ હોય. ઈમામે બરહુક (અ.સ.) પોતાના આ બરસ્તાવંતા નામના અર્થસુચક ઈશારાથી એ ફરમાવે છે કે દરેક જમાનાના ઈમામને ખુદાવંદ તખાલાથી મદ્દ મળતી રહે છે. અહીં શખ્સ “મદ્દ”નો ખુલાસો જરૂરી છે. કેમ કે તે ઓછામાં ઓછી પાણ છે અને વધુમાં વધુ પાણ. માટે આપણે એ જાગૃગું જોઈએ કે એ ઉચ્ચ મુજામની ઈમામ અલોહિસ્સલામને ખુદ તખાલાથી જે મદ્દ મળી છે તે અત્યંત મહાન છે; અને તે એ છે કે પાક-પવિત્ર ઈમામમાં ખુદાનું નૂર છે અને નૂરમાં સર્વ કાંઈ છે.

મુઈજ લી દીનીલ્લાહ : મૂળ ઐન, જે, જે, અને દાલ, યે, નૂર છે. અર્થ : તે શખ્સ જે ખુદાના દીનને ઈજાજત અને મજબૂતી આપે.

ઇમામે આતે મુહમ્મદ અલોહિસ્સલામનું આ નામ ઈઝાતનો વિષય બન્યો છે; અને જોઈ પાગ મોમીનને એ વાતમાં શું શંકા હોઈ શકે છે, જ્યારે સધણી ઈજાત ખુદા, રસૂલ (સ.અ.વ.) અને પવિત્ર ઇમામો (અ.સ.)ના માટે છે. જેમ કે ફરમાવવામાં આવ્યું છે કે, “૨ લિલાહી ઈજાતુ વર્સુલેહી વલ મોમનીન...” ૬૩/૮. જોકે ખરેખરી ઈજાત અલ્લાહના માટે છ અને તેના રસૂલના માટે; અને મોમીનો (અર્થાત ઇમામો) માટે. પરંતુ મુનાફ્કો તે જાગૃતા નથી. આ વિષય કુરાની હિકમતના સિદ્ધાંતોમાંથી છે કે કુરાનમાં જ્યાં જ્યાં વખાગના અર્થામાં મોમીનનો ઉલ્લેખ થયો છે, ત્યાં એ વખાગનો હેતુ અસલી ઇમામો થાય છે. કેમ કે ઇમામના ઉચ્ચયતર દરજા ઉપર તેઓ-સાહેબો જ હોય છે. જોકે દીનમાં એક જાહેર છે અને એક બાટિન છે. દીનના બાટિનને ખુદાએ ઇમામથી સંબંધિત રાખેલ છે; અને દીનના જાહેરને લોકો ઉપર છેડી દીખેલ છે, જેથી કાલે ક્યામતના દિવસે તેઓને પૂર્ણવામાં આવે.

અગ્રીજ બિલાહ : ઐન, ઐ. ઐ મૂળ છે. અગ્રીજ બિલાહ : તે શાખસ જેને ઈજાત અને શ્રેષ્ઠતા-પ્રભળતા અર્પણ કરી છે. યાદ રહે હજરત ઇમામ અગ્રીજ બિલાહના આ શાહી નામની સાથે સાથે એક દર્શાણી નામ પાગ હતું; અને તે હતું ‘નીજાર’. જે ફારસી શબ્દ છે, જેનો અર્થ છે અરાકન અને નબળો, કમજોર. આ નામ સર્વપ્રથમ હજરત ઇમામ કાયમ બિ અમિલાહની સાથે સંબંધિત જાગ્યાય છે. ઇમામે હક (અ.સ.)ના આવા બે વિરોધાભાસી નામોની હિકમત એમ કહે છે કે ચોક્કસપાગે ઇમામની મુખારક હસ્તીની હંમેશા બે બાજુ હોય છે. એક નૂરાનીયત અને બીજી જીસ્માનીયત

(શારીરિક). નૂર નિઃશંક મજબૂત અને ધ્વાયેલું છે; અને શરીર નૂર વગર નબળું-કમજોર છે, માટે જે લોકો ઈમામની નૂરાનીયતને એ રીતે સમજે છે કે રીતે સમજવું જોઈએ, તો તેમને જીસ્માનીયત (શારીરિક) સિદ્ધાંત-કાયદો કંઈ પાણ નુકસાન નથી પહોંચાડી રાખ્યો; અને જે લોકો ઈમામની જીસ્માનીયત અને તેના મનુષ્ય હોવાની માન્યતામાં બંધાઈ જાય છે, તો તેઓ વહેમ અને શંકાના તોષણમાં સપદાઈને મરી જાય છે.

મહાન ઈમામના એવા નામમાં એ હિકમત પાણ છે કે જોકે મોમીનને દેરેક વખતે નમ્ર જ રહેવું જોઈએ, દાંય સફળતાના સમયે તેની વધુમાં વધુ જરૂર હોય છે, જેથી દિલમાં અભિમાનની ક્રેચ અડચ્યાળ (દખલ) ન આવે અને શિસ્ત સાથે શુક્રગુજારી અદા કરી શકે.

હક્કીમ બિ-આપ્રેલાહ : મૂળ હે, કાંઈ, મીમ. હક્કીમ બિ-આપ્રેલાહ = ખુદાના છુક્મ (અપ્ર)થી છુક્મ અને (ઇસલો) ન્યાય કર્ણાર. ખુદાના અપ્રથી (છુક્મત) રાજ્યકર્ણવાવાળો. આ જ્યાએ એ બાબત ધ્વાનમાં લેવા યોગ્ય છે કે કહેવા ખાતર તો ધારા જાણ કહ્યા કરે છે કે તે જે છુક્મ અથવા (ઇસલો) ન્યાય કરી દીધા કરે છે, ખુદાના અપ્રથી કરે છે. પરંતુ આ ગૃહ, પૃથ્વી ઉપર ફક્ત ઈમામ જ એક એવો (હક્કીમ) રાજા છે, જે ખરેખર ખુદા અને રસૂલ (સ.અ.વ.)ના અપ્ર અને ઈચ્છા મુજબ ન્યાય (ઇસલો) કરતો રહે છે. બસ, જે માટે ફરમાવવામાં આવ્યું છે કે, “ઈન્ના અન્યાના ઈલેક્ટ જીનાબ બિલ છુફી....” ૪/૧૦૫. “અય રસૂલ (સ.અ.વ.) ! બેશક અમોએ તારી તરફ આ પુસ્તક સત્યતા સંભિં ઉત્તાર્યું છે કે જેથી જે કંઈ

(રૂહાનીયતમાં) અલ્લાહે તને દેખાડ્યું છે, તે મુજબ તું માણસો વચ્ચે ન્યાય કરો." અહીં (જે કંઈ અલ્લાહે તને દેખાડ્યું છે)નો ઈશારે કુરાનની રૂહ અને રૂહાનીયત તરફ છે, જે ખાસ ઇક્સ પયગમ્બર (સ.અ.વ.) અને ઈમામ (અ.સ.)ને માટે છે. માટે ખુદાના અગ્રથી કુરાન શીખવનાર (કુરાનના કેળવાળી આપનાર) ન્યાય કરનાર ઈમામ જ છે.

આહીર : મૂળ જોયે, હે, રે. આહીર : પ્રત્યક્ષ, જાહેર, મદ્દ કરનાર, શક્તિશાળી, વિજેતા. હજીત ઈમામ અલૈહિસ્સલામનું આ હિક્મત ભરપૂર નામ અર્થ સાથે ખુદાના ધર્મના ગૌર્વ તથા બળ-શક્તિ માટે હતું. જ્ઞાનીઓ જાગે છે કે "અલાહીર" ખુદાના ગુણવાચક નામોમાંથી છે. માટે જો ક્રેચ શાખ્સ ઈમામે બરહ્ક (અ.સ.)ને ખુદાનું તે નૂર માને છે, જે તેની (ખુદાની) તરફથી જગતમાં માર્ગદર્શિન (હિદાયત) માટે નિયુક્ત-નક્કી થયેલ છે, તો પછી તેનો અર્થ એ થયો કે ઉચ્ચ મુકામી ઈમામ (અ.સ.) ખુદાનું તે નામ છે, જેને "અલ-નૂર" કહેવામાં આવે છે; અને જો એ સાચું છે, તો એ પણ વાજબી છે કે ઈમામે બરહ્ક (અ.સ.) ખુદાનું એ ગુણવાચક નામ "અલાહીર" છે, કેમ કે નૂર અને જાહીરનો અર્થ એક જ છે.

મુસ્તનસીર બિલ્લાહ : મૂળ છે નૂત્ન, સ્વાદ, રે. મુસ્તનસીર બિલ્લાહ = ખુદાના હુકમથી મદ્દ માંગવાવાળો, પાક અને પવિત્ર ઈમામ અલૈહિમુસ્સલામનું આ નામ જે દરેક પ્રકારની બરહ્તોથી ભરપૂર છે, તે (તાઈદ) મદ્દનો વિષય છે. ખુદા તચાલાથી મદ્દ માંગવાના ખાસ અને સાખાન્ય એવા ધાર્યા જુદા જુદા પ્રકારના દરજાઓ છે. એટલે સુધી કે-એક એવો દરજી પણ આવેલ છે, જ્યાં મદ્દ

પહેલેથી જ હાજર હોય છે; અને તે પોતે પોતે જ કામ કરે છે અને એ મુકામ—એ દરજાઓ પાક-પવિત્ર ઉચ્ચતમ હજસન ઈમામના રૂર અને નૂરાનીયતનો છે.

નીઝર : આ ફારસી ભાષાનો શબ્દ છે; અને તેનો અર્થ છે અરસન, કમજોર, નાન્ય. હજસન મૌલાના ઈમામ નીઝર સત્ત્વાતુદ્વાહ અલેહિના આ બરકતવંતા અને છિકમતભર્યા નામથી છિદાયતનો એ પ્રકાશ મળે છે કે મોમીન બંદાએ નમૃતા અને દીનતાની રીત ધારણ કરવી જોઈએ. કારણ કે સફળતા અને પ્રગતિની સઘળી છિકમતો તેમાં જ દુઃપાયેલી છે. દાખલા તરીકે : (૧) જ્યાં દુઅા એ ઈબાદતનું સાસત્ત્વ છે, ત્યાં નમૃતા પ્રગટ કરવી. દીન પણે રજૂ થવું એ દુઅાનું એક અગત્યનું અંગ છે. (૨) ધમંડ (અભિમાન) એ ચારિય અને રૂહાની બાબતમાં સૌથી મોટો રોગ છે; અને તેનો અટકાવ ફક્ત નમૃતા અને આણજી થકી જ થઈ શકે છે. (૩) તોબા કરવી એ રૂહાની પવિત્રતા છે, પાણ આણજી (નમૃતા) એ તેનો જીવ છે—તેની જાન છે. (૪) નફસ (મન) ખૂબ જ શક્તિશાળી શકું છે; અને તેને ફક્ત આણજી વડે જ હરાવી શકાય છે. (૫). જો ક્રોછ વસ્તુ મોમીનને નૂરાનીયતમાં ફના થઈ જવાની નઅદિક લઈ જઈ શકે છે, તો તે છે આણજી.

હાઈ : મૂળ છે હે, દાલ, યે = હાઈ : છિદાયત કરવાવાળો, માર્ગદર્શક, રહેબર, પેશવા, ઈમામ. હજસન મૌલાના ઈમામ હાઈ (અ.સ.)નું મુખાચ નામ નૂરે ઈમામતના ધારણા અગત્યના નામોમાંથી છે, કેમ કે છિદાયત કે જે સાચા હાઈનો ગુગુ છે તે કુરાન અને ઈસ્લામનો સૌથી વિશાળ વિષય છે. એટલા માટે કે

હિદાયત જ્ઞાન પાગ છે અને નૂર પાગ. તે વાગ્દી પાગ છે અને વર્તન પાગ. તે જાહેર પાગ છે અને બાતિન પાગ. તે નાના સૂક્મ દરજજા ઉપર પાગ છે અને મોટા ઉચ્ચ દરજજાઓ ઉપર પાગ. તેમાં ખુદાનું પ્રતિનિધિત્વ પાગ છે અને પયગમખર (સલમ)નું પ્રતિનિધિત્વ પાગ.

મુહંતદી : મૂળ છે હે, દાલ, યે = **મુહંતદી :** હિદાયત પામનાર, હિદાયત મેળવેલ, જેને હિદાયત મળી ચૂકી છે તે. હજસન ઈમામ મુહંતદી (અ.સ.)નું નામ પાગ હિદાયતથી સંબંધિત છે. યાદ રહે કે જે રીતે પ્રત્યેક કામનો એક છેવટનો હેતુ હોય છે તે જ રીતે હિદાયતનો પાગ એક છેવટનો હેતુ છે; અને તે છે સિરાતે મુસ્લિમની છેવટની મંજિસ. અર્થાત મંજિલે મકસૂદ કે જ્યાં મોમીન અભેકુલ (સર્વશક્તિમાન)થી મળી જાય છે. (વાસલ થઈ જાય છે).

કાહેર : મૂળ છે કાદ, હે, રે = **કાહેર = જબરદસ્ત, વિજયી.** આ ખુદાના ગુરુગવાચક નામોમાંથી છે. જેમ કે ફરમાવેલું છે કે, “સમેનલ મુલ્કુલ યવમ.... અર્થ : “આજે હુક્મત કોની છે ? ખુદાની છે, જે એક જ છે અને જે સર્વશક્તિમાન છે (જબરદસ્ત છે).” અહી જબરદસ્તથી સૌને છેવટના મુકામે એક કરી દેવાનો ઈશારો છે. અર્થાત : “જે દિવસે ખુદાની રૂહાની હુક્મત કાયમ થશે (સ્થપાશે), તે વખતે સધળા લોકોને ખુદાની શક્તિથી (જબરદસ્તીથી) એક કરી દેવામાં આવશે.”

અહી ઉચ્ચ મુકામી ઈમામ સત્ત્વાતુલ્લાહ અલૈહિનું પૂરું નામ “અલ કાહીર બિ-કુલ્લાતીલ્લાહ” છે. અર્થાત : ખુદાની શક્તિથી વિજયી થનાર, ખુદાના તરફથી જબરદસ્ત. આનો અર્થ એ છે કે ઈમામે બરહુક ખુદાનું જીવંત નામ હોય છે. માટે ઈમામ (અ.સ.) ખુદાના સર્વ ગુરુગોનું

આહેરી સ્વરૂપ અને ખુદાના ગુણમનું પ્રતિબિંબ છે.

હસન અલ જીકરી હિસ્સલામ : નામ હસન અને લક્ષ અલ જીકરી હિસ્સલામ છે. હસનનો અર્થ જેમ કે આરંભમાં જગ્યાવ્યું છે તેમ અકલ, રૂહ અને શરીરમાં અત્યંત ખૂબસૂસ અને સુંદર થાય છે. અલા જીકરી હિસ્સલામનો અર્થ છે, “તેની યાદ ઉપર સલામ હો” જેમ પ્રત્યેક ઈમામનું નામ લેતી વખતે કહેવામાં આવે છે. “સલ્લાલુલ્હાલ અલ્હોહિ વસ્સલામ”. અર્થાત : “તેના ઉપર ખુદાની સલવાત અને સલામ હો.” સલામની તાવીલ છે ઉચ્ચ મેં અર્થાત નૂરની ભરપૂર મેં.

અલા મહમેદ : મૂળ છે એન, લામ, વાવ. અલા = સૌથી બુલંદ-ઉચ્ચ. અલા મહમેદ = તે માનવી જે ખુદા અને મુહમ્મદ રસૂલુલ્હાલ (સ.અ.વ.) તરફથી દુનિયાવાળાઓમાં સૌથી ઉન્તા-ગૌરવશાળી અને પ્રભ્યાત હોય, અર્થાત ઈમામ, પાક અને પાવિત્ર, સલ્લાલુલ્હાલ અલ્હોહિ કે જેઓ નૂર-ધારણ કરનાર હોવાને કારણે સૌથી ઉચ્ચ અને ઉત્તમ છે. જેમ કે ઈમામે આવે મુહમ્મદ (અ.સ.) અને અવલાદે અતી (અ.સ.)ને હેતું જોઈએ.

જલાલુદીન હસન : મૂળ છે જીમ, લામ, લામ. જલાલુદીન = દીનની જાયાઈ અને વિશાળતા. હજસન ઈમામનું મુખારક નામ હસન હતું અને લક્ષ જલાલુદીન. એ માટે જલાલુદીન હસનનો અર્થ છે આહેર અને બાતિનની સંઘળી ખૂબીઓ ધરાવનાર, જે દીનની વિશાળતા છે, બુરુરી છે. અથવા એમ કહીએ કે હસન દીનની જાયાઈ છે. એ વાત બધા માને છે કે ઈસ્લામ કુદસનો દીન (દીને હિતસત) છે, પણ લોકો એ નથી વિચારતા કે તેનો અર્થ શું છે. અર્થ એ છે

કે આં હજસ (સલ્વમ) ઈસ્લામના વૃક્ષના બીજની જેમ હા. તે માટે તેઓના જ પવિત્ર અને ઉચ્ચ વ્યક્તિત્વના ગુણથી ઈસ્લામનું વૃક્ષ પેદા થયું અને કુટ્યું-ફાલ્યું કે જેથી તેઓના પવિત્ર વ્યક્તિત્વમાં જેટલી ખૂબીઓ હની, તે સધળી ઈસ્લામના વૃક્ષમાં ફેલાઈ ગઈ; અને પદ્ધી ઈમામ (અ.સ.) એ વૃક્ષનું ઇન હંતું તેથી દીને ઈસ્લામની સધળી ખૂબીઓ ઈમામના વ્યક્તિત્વમાં એકઠી થઈ ગઈ.

અલાઈદીન : મૂળ ઐન, લામ, વાવ. અલા = જીયાઈ, કુલીનતા (શરાક્ત), અલાઈદીન = દીનની જીયાઈ અને શરાક્ત. જીયાઈ બે પ્રકારની હોય છે, ભૌતિક અને રૂહાની. અહી જે જીયાઈનો ઉદ્દેખ છે તે રૂહાની જીયાઈ છે. જે અક્ષલ, જ્ઞાન અને વિજ્ઞતાના નૂરની જીયાઈ છે. પાક-પવિત્ર ઈમામનું પૂરું નામ અલાઈદીન મુહમ્મદ (અ.સ.) છે, જેનો અર્થ છે દીનની જીયાઈ અને કુલીનતા (શરાક્ત) મુહમ્મદ સલ્વલાહ અલૈહિ વસ્સાલમ છે; અને આનો અર્થ છે તે શખ્સ જે ખુદા અને મુહમ્મદ સુલુલાહ (સ.અ.વ.)ના તરફથી દીનની જીયાઈ છે. અર્થાતિ (ઈમામે જમાન) ઉચ્ચ મુકામ ધરાવનાર ઈમામ.

કુનુદીન ખુસ્લાહ : મૂળ છે રે, કાદ, ગૂર = રુક્નુ : ટેકો, આધાર, સતંભ, શક્તિનું મૂળ. રુક્નુદીન = જેની ઉપર દીનનો આધાર હોય અર્થાતિ દીની શક્તિનું મૂળ. દીનનો સતંભ, ખુર (ખુરશીદ = સૂર્ય) શાહ = બાદશાહ કે જે સૂર્ય જેવો છે. મતલબ કે મહાન ઈમામ કે જે દીની શક્તિઓનું મૂળ અને સૂર્યના જેવો બાદશાહ છે. સૂરજ કે જે નૂરે હિદાયતની ઉપમા છે, બે પ્રકારે કામ કરે છે. એક એ કે સીધી રીતે પ્રકાશ વેરે છે. બીજું એ કે ચંદ્ર માર્ગત પ્રકાશ ફેલાવે છે. તે રીતે નબુવ્યતના સમયમાં પયગમ્બર (સલ્વમ) સૂરજ અને અસાસ ચંદ્ર છે.

અસાસના કાળમાં અસાસ (અ.સ.) સુરજ અને ઈમામ (અ.સ.) ચંક છે; અને ઈમામતના જમાનામાં ઈમામ (અ.સ.) સુરજ અને બાબ (ઈમામતનો વાસ્યદાર) ચંક છે. એ જ અર્થમાં કુરાને સુરજને પ્રકાશ અને ચંકને તેજસ્વી ક્ષેત્ર છે. (૧૦/૫) ૭૬/૭૬. અહીં પ્રકાશ અને દીવો અસલ રોશાની છે; અને નૂસો હેતુ એક એવી રોશાની છે જે પ્રતિબિંબ થઈ જાય છે—પરાવર્તન પામે છે.

શાસ્ત્રીદીન મુહુર્મદ : મૂળ છે શીન, મીમ, સીન. શાસ્ત્ર = સૂર્ય. શાસ્ત્રીદીન = દીનનો સૂર્ય. શાસ્ત્રીદીન મુહુર્મદ = મુહુર્મદ દીનનો સૂર્ય છે, તો આનો અર્થ છે તે શાખ્સ, તે માનવી, જે ખુદા અને મુહુર્મદ રસૂલુલાહ તરફથી દીનનો સૂરજ હોય. અર્થાત ઉચ્ચ મુકામી ઈમામ (અ.સ.) હાઈએ બરહ્ક (અ.સ.) ઈમામનું આ બરકતવંતુ નામ તે આયતે કુરાની મુજબનું છે, જેમાં નૂરે હિદાયતની ઉપમા સૂરજથી આપવામાં આવેલ છે. આ પ્રમાણેની આયત ફક્ત શાદ “શાસ્ત્ર”ના સાથે જ નથી, પરંતુ મરિયુ, મગારિય (પૂર્વ-પદ્ધતિમ) સમા (સ્વર્ગ) નૂર વગેરે સાથે પાગ છે.

કાસીમ શાહ : મૂળ છે કાશ, સીન, મીમ. કાસીમ = વહેયનાર (તકસીમ કરનાર). કાસીમશાહ = તે બાદશાહ જે વહેયાળી કરે છે. અર્થાત ઈમામે બરહ્ક (અ.સ.) જે ખુદાના હુકમથી ઈલાહી ખજાનાની દરેક વસ્તુ વહેયે છે. જેમ કે ઈરશાદ ફરમાવવામાં આવેલ છે કે “શું તેમની પાસે તારા પદ્યરાણિગાસના ખજાના છે અથવા શું તેઓ તેના દારોગા છે?” ૫૨/૩૭. આનો હેતુ એ છે કે ઈમામો સત્યાતુલ્લાહ અલોહિમ ખુદાના ખજાનાદાર—ખજાનો રાખનાર છે. અને એ અર્થમાં દરેક ઈમામ કાસીમ એટલે કે વહેયાળી કરનાર છે.

ઇસ્લામ શાહ : મુણ સીન, લામ, મીમ = ઇસ્લામ શાહ = ઇસ્લામનો બાદશાહ, દીનનો શહેનશાહ. પવિત્ર ઇમામ સલ્વાતુલ્લાહ અલૈહિને માટે બાદશાહની ઉપમા એક સર્વમાન્ય છીજા છે. આ અર્થનો કુરાની શબ્દ છે “માલિક” અને બીજો શબ્દ “મુલ્ક” છે; અને “મલ્કૂત” વગેરે. ખુદાના દીનમાં જો નભુવ્યતનો કાળ છે તો (તે જમાનામાં) પયગમ્બર (સ.અ.વ.) બાદશાહ છે; અને ઇમામ વકીર (મંત્રી) છે; અને જો સમય જમાનો ઇમામતનો છે, તો ઇમામ બાદશાહ છે; અને તેનો વાસદાર (વલીઅહુદ) વકીર છે.

મુહમ્મદ બિન ઇસ્લામ શાહ : હજરત ઇમામ સલ્વાતુલ્લાહ અલૈહિનું આ મહાન નામ સરવરે કાયેનાત રસૂલુલ્લાહ અલૈહિ વ આલૈહિ વ સલમના બરકતવંતા નામ ઉપર છે. કેમ કે ઇમામ (અ.સ.) ખુદા અને રસૂલ (સ.અ.વ.)નું નૂર હેય છે. આ પવિત્ર નૂરના કેટલાં ય સંબંધો છે. જેમ કે નૂરે કુરાન, નૂરે ઇસ્લામ, નૂરે હિદાયત, નૂરે અલી, નૂરે માર્ઝન, નૂરે વહેદત, નૂરે ઇમાન વગેરે; અને એક જ નૂરના ઘણગા બધા નામો હોવામાં કોઈને શંકા રા માટે હોવી જોઈએ, જ્યારે કે ખુદા અને રસૂલ (સ.અ.વ.)ના પણ ઘણગા બધા નામ છે.

મુસ્તનસીર બિલાહ : મૌલાના મુસ્તનસીર બિલાહ અલૈહિસ્સલામનું આ મુખાસ્ક નામ આથી પહેલાં પણ વર્ગનિમાં આવ્યું છે. અહી ઈજન એટલું જીગાવવાનું છે કે ખુદાની મદ્દ રસૂલ (સ.અ.વ.) અને ઇમામ (અ.સ.)ના માર્ઝન કોઈને પણ મળી શકે છે; અને દીન તથા આખેસતનાં કામોમાં ખુદાની મદ્દ અને સહાય હોવી જોઈએ, માટે ખુદાની જીવંત અને બોલતી મદ્દ ઇમામે જમાન સલવાતુલ્લાહ અલૈહિ છે.

અણસ્સલામ : મૂળ છે જૈન-બે-દાલ. અણ = બંધુ,
ગુલામ = સલામત, સલામતી. ખુદા તથાલાનું નામ.
અણસ્સલામ = ખુદાનો બંધુ, સલામતીવાળાનો ગુલામ. જો ક્રોછ
અન્ય માનવીનું નામ અણસ્સલામ હોય તો તે ફક્ત શાહેદક
અર્થમાં જ અણસ્સલામ હશે. પરંતુ તેથી વિશુદ્ધ ઈમામ તો હ્જીકી
અર્થમાં અણસ્સલામ છે. તે એમ કે ઈમામે બરષક (અ.સ.) ખુદાના
પસંદ થયેલા બંદા છે, જેથી તે ખુદાની સલામતીને લોકો સુધી
લાવે છે; અને લોકોને ખુદાની સલામતી સુધી પહોંચાડી હો છે. તે
સિવાય ઉચ્ચ મુકામી ઈમામ (અ.સ.) પોતાના મુખાખ વ્યક્તિત્વમાં
અસ્થાન (જાયાઈ) ઉચ્ચ ક્ષાના આરીઝ-ખુદાને ઓળખનાર-છે, માટે
તેમની ઈખાદત નૂરાનીયત અને કમાલીયતથી ભરપૂર છે.

ગરીબ મીર્જ : મૂળ જૈન-રે-બે. ગરીબ = અજ્ઞાય્યો,
વતનથી દૂર, અનોખું વિચિત્ર. મીર્જ = અમીરાદ્દી, શાહીદ્દી. ગરીબ
મીર્જ = અનોખો શાહીદ્દી, પરદેશી અજ્ઞાય્યો શાહીદ્દી. ખરેખર
પવિત્ર ઈમામ (અ.સ.) દુનિયાવાળાઓથી નિરાળા-અનોખા પણ છે
અને અજ્ઞાય્યા પણ. કેમ કે લોકો તેમને નથી ઓળખતા-નથી જાણતા.
જેમ કે હ્જીસમાં આવ્યું છે કે ઈસ્લામનો અનોખા સ્વરૂપમાં (વિચિત્ર)
આરંભ થયો; અને છેષટે જઈને ફરીથી વિચિત્ર (અનોખો) થશે. આમ
ઈસ્લામ અને ઈમામ (અ.સ.) અનોખા અને વિચિત્ર છે (અજ્ઞાય્યો
ગરીબ છે). મતલબ કે તેમના બાતિન જ્ઞાનના પ્રકાશ અને છિકમતની
અજ્ઞાયબીઓ અને વિચિત્રતાઓથી ભરપૂર છે; અને ઈમામ (અ.સ.)
અજ્ઞાય (પરદેશી) એ અર્થમાં છે કે તેમનો દેશ (વતન) ઊચ જગત
છે. તએ અજ્ઞાય્યા એ માટે છે કે લોકો તેમને એ રીતે નથી

ઓળખતા, જેમ કે ઓળખવાનો હક છે. તેથી જ ફરમાવ્યું છે કે
“સત્ત્માન ગરીબમ કણ્ઠીતુ...”

અબુજર્જ અલી : મૂળ છે અલીએ, અને ઝરર = અબુ=
પિતા; ઝર = કણ. જેનું બહુવચન છે રજકુગો (ઝરીત) છે. અબુજર્જ
અલી = જે રજકુગોનો પિતા છે. અર્થાત પવિત્ર ઈમામ કે જે રૂહોની
રજકુગોનો પિતા છે, જે પોતે રજકુગોનું જગત છે (આલમે ઝરીત છે).
મતલબ કે જેની અંદર સધળી રૂહો સુક્ષ્મ રજકુગોના સ્વરૂપે એકઠી
થયેલી છે, જેથી તેમની એકતા અને પુષ્ટણતાનો દાખલો આપી
શકાય. યાદ રહે કે માનવીમાં ત્રાગ મૂળભૂત (દાખલાઓ) ઉપમાઓ
મોજૂદ છે. અક્ષલમાં એકતાની ઉપમા છે, જે સૌથી ઉપર છે. શરીરમાં
પુષ્ટણતાની ઉપમા છે, જે સૌથી નીચે છે; અને રૂહમાં તે બંનેની
ઉપમા છે (અર્થાત એકતા અને પુષ્ટણતા). તેમ કે તે દરમિયાનમાં છે,
જેથી રૂહ એક પ્રાગ છે અને અનેક પ્રાગ.

મુરાદ મીરજા : મૂળ રે, વાવ, દાલ = મુરાદ = ઈરાદો કર્યો,
ઈચ્છામાં આવ્યું. મુરાદ મીરજા = એ શાહજાહો જેને બધા ઈચ્છે
(જેને મળવા બધા ચાહે. અર્થાત આદર્શ અને પવિત્ર ઈમામ (અ.સ.)
જેની દેખને ઈચ્છા હોય, જેને સૌ ચાહે તેને માટે કોઈ શંકા નથી કે
એક મોખીન છે તે મુરીદ (ચાહનાર) ઈચ્છા કરનાર છે; અને પવિત્ર
ઈમામ (અ.સ.) મુરાદ (જેને ઈચ્છામાં આવ્યું તે, જેને ચાહવામાં
આવ્યું તે) છે. અર્થાત તે (ઈમામ) રૂહની-જાનની ઈચ્છા-ચાહત છે.
આમ તો ઈમાન રાખનાર દેખની દીની અને દુન્યવી ઈચ્છાઓ
ઘણી વધારે હોય છે; અને તે દેખે ઈચ્છાઓ કમ પ્રમાણે (તસ્તીલ
મુજબ) પણ છે, પરંતુ સધળી ઈચ્છાઓની ઈચ્છા અથવા સૌથી છેલ્લી

અને મહાન ઈરદ્ગા ઈમામે જમાન (અ.સ.) છે. કેમ કે તે જ વ્યાપક શીતે બહોળા અર્થમાં ઈલાહી ખજાનાનો ભેદ છે.

ઝુલ્લિકાર અલી : મૂળ જે, વાવ, અને કે, કાદ, રે. ગુ = વાળો, સાહેબ. ઝુલ્લિકાર : તે તલવાર જેની (પુષ્ટ) કરેડરજણું બરડાના હાડ્ક જેવી હોય, જેમ કે કહેવામાં આવે છે કે “સૌકુન મુફક્કર” તે તલવાર જેની પાછળા (પીઠમાં) ચીરો પાતેલો હોય. ઝુલ્લિકારે અલી : અલી (અ.સ.)ની ઝુલ્લિકાર. ઈમામે આવે મુહમ્મદ (અ.સ.)નું આ પવિત્ર નામ તન્નીલી અને તાવીલી જેહાણની નિરાની છે. તન્નીલી (જાહેરી) જેહાણને તો સૌ ક્રેચ જાગે છે, પસ્તુ તાવીલી જેહાણને તેના જુદા જુદા પાસાઓ વડે સમજ્યું લોકેના વરામાં નથી. લોકેના ગજા બહારની વાત છે. જ્યારે કે આ તો જાહેરમાં પાગ છે અને બાતીનમાં પાગ. બુદ્ધિમય પાગ છે અને જ્ઞાનમય પાગ. જાની (રૂહાની) પાગ છે અને માલી પાગ. (ધન-સંપત્તિને લગતું-આર્થિક પાગ) આસમાની લખણી મદ્દ થકી પાગ છે અને ધરતીના લખ્કર મારણત પાગ.

નુરુદ્દીન અલી : મૂળ નૂર, વાવ, રે. નૂર = દીનનો પ્રકાશ. નુરુદ્દીન અલી : અલી દીનનો પ્રકાશ છે. તે શાખ્સ જે અલીના તરફથી દીનનો પ્રકાશ છે. અર્થાત આવે નબી મુહમ્મદ (અ.સ.) અને અવલાદે અલી (અ.સ.)નો ઈમામ. હજસન ઈમામ અલૈહિસ્સલામનું આ હિકમતસલ્બર નામ ધાર્યું મહત્વનું છે. કેમકે “નૂર” એ કુરાનમાં સૌથી જિજ્ઞાસુણ વિષય છે. જેમાં સારાંશરૂપે એક જ નૂરનો ઉલેખ છે, એમાં નૂરની હકીકતનો જુદી જુદી બાજુઓ મુજબ આયતે મિસલાઈ (૨૪/૩૫)માં ખુદાની કૃત્પના (તસબ્બુર) છે. આયતે સિરાજ (૩૩/૪૬)માં રસૂલ (સ.અ.વ.)ની અને આયતે મસાબીઈ

(૪૧/૧૨-૬૭/૫)માં હજરત ઈમામોની કલ્પના છે.

ખલીલુલાહ અલી : મૂળ જે, લામ, લામ. ખલીલ = ફ્કીર (મોહનાજ), દાખિલ, વિશ્વાસુ (સાફ) મિત્ર. ખલીલુલાહ = ખુદાનો ફ્કીર, અર્થાત એવો શખ્સ જેને ખુદાએ પોતાની ખાસ તરફદારી (ઈનાયતો)ના માટે ફ્કીર (જરૂરમંદ) ઠેસેલો હોય. ખુદાનો (સાફ-પવિત્ર) વિશ્વાસુ મિત્ર. હજરત ઈબ્રાહિમનો લક્ષ્ય. ખલીલુલાહ અલી = અલી (અ.સ.) જે ખુદાનો ફ્કીર અને વિશ્વાસુ મિત્ર હો. તે ઈમામ જે અલી (અ.સ.)ની અવલાદમાંથી ખુદાનો ફ્કીર અને વિશ્વાસુ મિત્ર છે. દેખ ઈમામે જી ગુરાનીયતની લેટ-સોગાતનો ફ્કીર અને અલાહનો વિશ્વાસુ મિત્ર છે. જે રીતે હજરત ઈબ્રાહિમ (અ.સ.) વિશે ફરમાવેલું છે કે.....(૪/૧૨૫) “અને ખુદાએ ઈબ્રાહિમને પોતાનો મિત્ર કરી લીધો છે.” હજરત મૂસા વિશે ફરમાવેલું છે કે.....(૨/૨૪) “અને (મૂસાએ) દુઆ માંગી કે, હે મારા પરસ્વરણિયાર ! જે પણ નેભમત તું મારા માટે જાઓ તેનો હું ખરે જ મોહનાજ દું.” આ રીતે ખુદાના ફ્કીરનો અર્થ આવી જ સપાટી મુજબનો છે.

નીઝર : આથી અગાઉ નીઝર શબ્દ વિશે ઉત્ત્લેખ કરેલો છે કે હાદીએ બરષકુનું આ મુખારક નામ ઈમાન ધરાવનારાઓને નમૃતા અને વિચેનો પાઠ શીખવે છે, કેમ કે સંધળી વિદ્વતા-ડાખાપણું નમૃતામાં છે. નફસ (મન)ની હાર અને બુદ્ધિની જમ આમાં જ છે કે સમતોતપણું અને નમૃતા-વિચેક ધારણ કર્યામાં આવે. એ માટે ફરમાવેલું છે : “અને (હે સ્સૂલ) તે નમ સેવકોને (રૂહાનીયતની) ખુશાખબરી સંભળાવી દે” (૨૨/૩૪)

સચ્ચીદ અલી : મૂળ સીન, અલીએ, દાલ. સેચ્ચીદ =

પેશવા—આગેવાન. હજસં ફાતિમા સલવાતુલ્લા અલેહાની અવલાદ અને નસલ (વંશ)વાળા, આલે રસૂલ. સચ્ચીદ અલી = અલી (અ.સ.) સરદાર છે. તે શખ્સ જે અલી તરફ થી સચ્ચીદ અને સરદાર છે અર્થાત ઈમામ છે. શબ્દ “સચ્ચીદ”નો આ અર્થ મગજબી જ્ઞાન સિવાય સત્તાવાર શબ્દક્રોષનાં પુસ્તકો મુજબનો પાણ છે; અને સત્તાવાર શબ્દક્રોષ એક બહુ મોટી તર્કની વસ્તુ હોય છે, તો જ્યારે એ વાત સર્વમાન્ય છે કે, સચ્ચીદનો અર્થ સરદાર અને આલે રસૂલ (સ.અ.વ.) ફક્ત તે શખ્સને કહેવામાં આવે છે, જે હજસં ફાતેમતુલ્લા જહેરા (અ.સ.)ની અવલાદ હોય. તો પદ્ધતિં સું એવા માનવતો હજસટો કે જે આલે મુહમ્મદ છે, તેઓ આયતે ઈસ્તકા ઉ/ઉર “નિઃસંશય અલ્લાહે આદમ તથા નૂહ અને ઈબ્રાહિમના વંશજોને તથા ઈમરાનના વંશજોને સધળી દુનિયા વાળાઓ ઉપર ચુંટી કાઢ્યા (છ)”ની ઉચ્ચતામાં શામેલ નથી થઈ રહ્યા ? જરૂર થઈ શકે છે. કેમ કે “આલે મુહમ્મદ (સ.અ.વ.)”ની આ સંજ્ઞા, આલે ઈબ્રાહિમ અને આલે ઈમરાન (અ.સ.)નો વિસ્તાર તથા સમજાગ છે (તરીકે છે).

હસન અલી : હસન = ખૂબસૂરત, સ્વરૂપવાન. હસન અલી = અલી (અ.સ.) તે રૂપ (હુસન) છે કે નૂરે મુદાની ખૂબીઓ સહિત આતીશાય સ્વરૂપવાન છે; અને તે રૂપ અલી તરફથી છે અને નૂરની રીતે (જોઈએ તો) આ પોતે અલી (અ.સ.) છે. રબ્બાની-ખૂદાઈ સ્વરૂપ-ખૂબસૂરતીનું મૂળ (ત્રસ્તું) નૂર છે; અને તે પદ્ધતિ રૂહ છે; અને શરીર તો ફક્ત એક પડદશયો છે.

કાસિમ અલી : કાસિમ = વહેચારી કર્ણાર. કાસિમ અલી = વહેચારી કર્ણાર અલી છે. અર્થાત ખૂદાના હુકમથી અલી (અ.સ.)

નર્ક અને સ્વર्गના ઉત્તરી ક્ષા તથા ચઢ્ઠી-ઉપર જન્મી પાયરીનો વહેયનાર (તકસીમ કલાર) છે; અને આજે દુનિયામાં પાગ અલી (અ.સ.) જ છે, જે ખુદાવંધી નૂર ની હેસિયતમાં બુદ્ધિ (અક્ષલ) અને જ્ઞાન (ઈન્દ્રિય)ની રોળ વહેય છે. તે મુજબ હજસન ઈમામ કાસિમ (અ.સ.)નું બજ્જાવંતુ નામ આ દોણ્ડોણ (નજરીયા)ને જ તાજું કરે છે.

અબુલ હસન અલી : અલી અબુલ હસન છે. આ ઈમામ અબુલ હસન અલીની નિયુક્તિ (તકર્રર) અલી ના તરફથી છે; અને તે અલી (અ.સ.)ની (ઓલાદ) વંશમાંથી છે. વળી અબુલ હસનની અટક (કુન્નિયત) પાગ મૌલા અલી (અ.સ.) છે. કેમ કે અલી (અ.સ.) જ ઈમામતનું મધ્યબિંદુ (મર્યાદ) છે. માટે એ જરૂરી છે કે ઈમામો, અવલાદે અલી (અ.સ.)ના મુખાચ નામો અસલ અને મધ્યબિંદુ તરફ પાદ્ધ ફરે; અને દેરક નામમાં નૂરના કોઈક પાસાનો ઉત્તેખ હોય

ખલીલુલ્લાહ અલી : આ પવિત્ર નામમાં સૌથી પહેલાં ખુદાની યાદ છે, જેનો છેતુ (ખુદાની) એકાની કલ્પનાનો છે. પદ્ધી ખુદાના વખાગ છે કે તેણે હજસન ઈબ્રાહિમ (અ.સ.)ને પોતાનો (ખલીલ) મિત્ર બનાવીને નૂરસી સંપત્તિથી (દીલતથી). માલામાલ ફરમાવ્યો. પદ્ધી અલી (અ.સ.)ના ઉત્તેખમાં એ ઈશારો છે કે નૂરનો (સિલસિલો) કમ ઈબ્રાહિમ (અ.સ.)ની આલમાં ક્યામતના કાયમ થવા સુધી જળવાયેલો છે; અને તે આલે મુહમ્મદ (અ.સ.) અને અવલાદે અલી (અ.સ.)માં છે. હજસન ઈબ્રાહિમ (અ.સ.)ને પોતાના સમયમાં એમ દોઓ માગી હતી કે “અય મારા રખ ! મને છિકમત (સંદ્ભુદ્ધિ)

આતાફરમાવં અને મનો સદ્ગયારીઓમાં બેળવી છે; અને હવે પછી આવનારા લોકોમાં મારી સત્યવાદી તરીકેની યાદ કાયમ રહે એમ કર." (૨૬/૮૭-૮૮) હુક્મનો સિદ્ધાંત એમ કહે છે કે ખુદાએ ઈશ્વરાંતીમને હિક્મત આપીને તેની (પોતાની) આલના નૂરે હિંદાયતની પરંપરા (સિલસીલા)થી મેળવી દીધો, તે એ નૂરમાં જીવંત છે અને હાણીએ બરષુક ને તેની અભાન ગાગવામાં આવી છે; અને સત્ય બોલનારી અભાનનો હેતુ જ્ઞાન (ઈલ્યમ) અને હિક્મત વાગ્યવાનો છે.

હસ્તનઅલી શાહ : "શાહ"નો આ મનગમતો અને વહાલો લક્ખ લગભગ દરેક ઈમામો માટે વપરાયો છે, કેમ કે ઈમામ ખરી રીતે તો બાદશાહ જ છે. અને રૂહાનીયતની રાજગાડીના બાદશાહની મોહલ્લાત ખૂબ જ મીઠાં ભરેલી હોય છે (મનગમતી હોય છે). "શાહ"નો કુરાનિક શાબુદ્ "માલિક" છે, જેનું બહુવયન મલ્ક છે; અને હુક્મની મોમીનને ઈમામ (અ.સ.)નું બાદશાહ હેવાની કૃષ્ણના થકી અતિરાય ખુશી એ માટે મળે છે કે તેમાં એક બહુ મોટે ભેદ છે, જે મુજફૂર આયતે કરીમામાં દુષ્પાયેલો છે : "અને (તે સમયને યાદ કરો) જ્યારે મૂસાએ પોતાની ક્રોમને કુછું કે, હે મારી ક્રોમ ! અખાહે તમારા પર કરેલી તે નાયતને યાદ કરો કે જ્યારે તમારામાં નબીઓ બનાવ્યા તથા તમને બાદશાહ બનાવ્યા." (૫/૨૦) એ ભેદ એ મુજબ છે કે મૂસાની ઉત્ત્મત - મૂસાને માનનારાઓમાંના સાચા મોમીનો પોતપોતાના સમયના ઈમામો (અ.સ.)ના નૂરમાં બાદશાહ હતા, કેમ કે ઈમામે અમાન (અ.સ.) મોમીનોની બુલંદ રૂહ નું નામ છે કે જે સંપૂર્ણ માનવી (ઈન્સાને કામિલ) તરીકે શરીર ધારણ કરેલ છે; અને આ મહાન નાયત દરેક જમાનાઓ માટે એકસરખી છે.

પવિત્ર ગુણા એ જ મુખ્યાંક જીમાથી “આગામાન”ના લક્ષણો આરંભ થયો છે. આ શબ્દની એક બાજુ—એક છબી—“આકા ખાન” પાય છે. આકા = બુગુર્દ, માનવંત ઉપરી, ખાન = માલદાર (રઈસ, અમીર) સરદાર. શબ્દના બન્ને ભાગો તુર્ફી ભાષાના છે. “આકાખાન”નો (ટ્રિનિકલ) અર્થ છે ખૂલ ઉચ્ચ અને અનુપમ—બેમિસાલ; અને એ જ કારણે ઈમામ (અ.સ.)એ તેને લક્ષ કરીને ગ્રહણ કરેલ છે.

અલીશાહ દાતાર : આ પવિત્ર નામનો અર્થ છે = હિન્દુ અમીરુલ મોમનીન અલી (અ.સ.) ધ્યાયે જ (સખી) ઉદાર બાદશાહ છે. આ માનવંત ઈમામ જેમનું નામ “અલીશાહ. દાતાર” (અ.સ.) છે, જીક્ષણમાં મુર્ત્તિઓ અલી બાદશાહ (અ.સ.) છે કે જે ધર્ણા જ ઉદાર (ફ્રિયાર) હાં. દાતાર = ફ્રેયાર, સખી, ઉદાર, અર્પણ કરનાર, બજાવાવાળો; કેમ કે ઈમામ અને પયગમ્બર સત્ત્વાતુલ્લા અદૈહિમ ખુદાના હાથ છે, તે માટે ખુદા તથાતા પોતાના એ હાથો વડે લોકોને ઈનામો આપે છે, તો ઈમામ (અ.સ.) ખુદાના હાથ તરીકે જે કંઈ અર્પણ કરે છે, તે દેશે વસ્તુથી ઉચ્ચ અને સદાય-હંમેશાની હોય છે. જેમ કુરાનની આયત (૨/૨૪૮)નો સાર છે કે ઈમામના રૂહાની બાદશાહ હેવાની સાખિતી એ છે (ઓળખ એ છે) કે તમારી પાસે તે (રૂહાનીયતની) પેટી પહોંચે કે જેમાં તમારા પરવરણિાર તરફથી દિલની શાંતિ (શાંતિનું કારણ) છે. વળી તેમાં આલે મૂસા તથા આલે હારુન (નબુવ્યત અને ઈમામત)ના જ્ઞાન અને છિકમત છે (અને) કૃસિતાઓએ તે (પેટી) જાયકેલી હો.” અર્થાત એ કક્ષ રૂહાની વસ્તુ છે, ભૌતિક નહિ. આ છે ઈમામે બરછજના રૂહાની રાજ્યની એક જીંયત-પ્રકાશિત દલીલ કે જે આયતે આલે ઈન્દ્રાહીમ (૪/૫૪)

“...તો બેશક અમોએ ઈશ્વરાહીમની અવલાદને કિનાબ અને મહાન બુદ્ધિ અર્પણ કરી હતી તથા તેમને ધારી મોટી સલ્તનત આપી હતી.”ના પ્રમાણે છે.

સુલતાન મુહમ્મદ શાહ : મૂળ છે સીન, લામ, તોય. સુલતાન = દલીલ, હુજ્જત, બળ, કણ્ણો, બાદશાહ. સુલતાન મુહમ્મદ = આ શાન્દાર મહાન અને બરકતવંતા નામમાં સલ્તનતે મુહમ્મદી (અ.સ.:)નો અર્થ મોજૂદ છે; અને ખરેખર હજરત ઈમામ સુલતાન મુહમ્મદ શાહ સત્ત્વાતુલ્લાહ અલોહિ વ સલામ તેમના અનુપમ વ્યક્તિત્વમાં રૂહાની બાદશાહના ધારી હતા. આમ તો સધળા ઈમામ પોતાના સમયમાં રૂહાની બાદશાહ હોય છે, પરંતુ ખુદાના મહાન કાર્યક્રમ મુજબ દરેક જમાનાઓ એક જેવા નથી હોતા, માટે હજરત ઈમામ સુલતાન મુહમ્મદ શાહ (અ.સ.)નો જમાનો ખૂબ અગત્યનો અને અતિશય ખાસ બલ્કે સૌથી મહાન હતો, કેમ કે કુરાની તાવીલ મુજબ-તેની ભાષામાં આપ (અ.સ.) જાતે એક ઉચ્ચ ગુગુ ધરાવનાર “લયલતુલ કક્ક” જેવા હાત કે જેમાં દરેક આત્મી કાર્યોના ફરિસ્તાઓ તથા મહાન રૂહો અને અન્ય રૂહાનીઓ નાત્તીલ થાય છે (જમીન પર જીતરે છે). મલઅંક અને રૂહોના નાત્તીલ થવાના હેતુ બે પ્રકાસના હોય છે : એક લોકેના ભૂતકાળથી હિસાબ લેવામાં આવે; બીજો એ કે ભવિષ્ય માટે એક મહાન કાર્યક્રમ બનાવવામાં આવે; તો આ “જીવંત લયલતુલ કક્ક”ના જમાનામાં ખુદાનો એ સમય-દૌર અમલમાં આવી ચુંઝો છે, જેનો ઉદ્દેખ કુરાન (૮૭/૧૩૩૫)માં ફરમાવેલ. (આ સુરતુલ કક્ક છે જેની પાંચ આયતો છે.)

યાદ રહે કે ફરિસ્તા હોય કે રૂહ તે કેટલાંય સતરો ઉપર

મળે છે. અથવા મલાએક તથા રૂહે મારુણતના મુજામ પર પોતાના હીકી રૂપમાં હોય છે, જેમને ક્રોછ પવિત્ર મનુષ્ય (આરીઝ) ત્યાં જોઈને આપણાં શકે છે, પરંતુ નીચાંલી કણાઓ ઉપર, દુનિયાવાળાઓને જેમને ફરિસ્તાઓ અને રૂહ આવીને મળે છે, તે નક્કર-કંઠણ (મુન્જમદ) હોય છે. મતલબ કે દુન્યવી જ્ઞાન અને હુનર તથા વિજ્ઞાનની દરેક વસ્તુ પોતાની અસલ અને મૂળભૂત સ્થિતિમાં એક નક્કર ફરિસ્તો અથવા રૂહ હોય છે. જેમ પાણી પોતાના સમગ્ર દેલાવાના દરેક સ્થળો પાણી નથી હોતું તે વરાળ એટલે કે બુખારાત, વાણ, બરફ અને વરસાદ વગેરે પાણ છે. જે રીતે આજના જમાનામાં વૈજ્ઞાનિકોએ આગુ-એટમનો પ્રયોગ કરીને તેને અલગ કરી તેમાંથી ઇલેક્ટ્રોન રૂપે નક્કર રૂહ મેળવી છે, તે જ રીતે ઉડ્ણી કાબીઓ એક પ્રકારના નક્કર ફરિસ્તા છે; અને એ સર્વ કાંઈ તે અતિશય મહાન ખુદાઈ કાર્યક્રમ મુજબનું છે, જેનો ઉલ્લેખ કુરાનમાં ટેક ઠેકાણે ફરમાવેલ છે. જે લયલતુલ કદ અને હિત કાયમુલ ક્યામત અલેઅફ્જલતાહિતા વસ્ત્સલામ વિશે છે.

શાહ કરીમ : મૂળ કાદ, રે, મીમ. કરીમ = બૃક્ષિસ કરનાર, દરગુજર કરનાર, માનવંત અને મહાન, માનનીય. આ ખુદાનું એક નામ છે અને તેના સંબંધે-તેને લગતું જ એક ગુમ નામ છે “અલ-અકરમ, અલ-અક્રમ, અલ-અકરમ” નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજીર ઈમામ (અ.સ.) = અર્થ = નૂરનો અર્થ છે બુદ્ધિ વિશેનું રહાની અને સદરતિન (અખલાક)વાળો પ્રકાશ. મૌલાનાનો અર્થ છે અમારો ધારી, અમારો માલિક. શાહ કરીમ અલ હુસૈનનીની સમજણ છે હુસૈની વંશનો ઉદાર બાદશાહ. હાજીર ઈમામનો અર્થ છે તે ઈમામ જેની ઓળખ અને તાબેદારી જમાનાવાળાઓ ઉપર વાજબ છે; અને

તે વગર આગલા ઈમામોની વિલાયત કરું નથી આવી શકતી. આ ઈમામ મહાન અને માનનીય છે, જે પવિત્ર ઈમામતના ક્રમ (સિલસિલા)માં (સાત સાતનો એક) સાતમો છે, જે એટમી (આગુના) જમાનાનો ઈમામ છે, જેની ઈમામતના પાછલા ભાગમાં (પાશ્વબ્લૂમિકામાં) એક મહાન ક્ર્યામત આવી ચૂકી છે, જેને દુનિયાના લોકોએ ઇકન રજુગ (આગુની દુનિયામાં નિહાળી, પરંતુ જાહેરી દુનિયામાં નથી નિહાળી. જેનું કારગ એ દીવાલ છે જે જાહેર અને બાનિનની વચ્ચે ઉભી કર્ત્વામાં આવી છે...વસ્તસલામ.

LS

ઇકન ખાઈમ,
—નસીરીન નસીર હુંગાઈ
(૨૪ ડિસેમ્બર, ૧૯૮૩)

Institute for Spiritual Wisdom and Luminous Science

Knowledge for a united humanity

